

રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

તા. ૧૦/૨/૨૦૧૪ થી તા.૧૬/૨/૨૦૧૪

ચિલઝડપના ગુના શોધી કાઢ્યા

તા.૦૬/૦૨/૨૦૧૪ ના રોજ ધોરાજી ખાતે મહિલા સન્માન યાત્રાનો કાર્યક્રમ હતો જેમાં ભાગ લેવા માટે જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન રામજીભાઈ સોજીત્રા ઉ.વ.૫૨ રહે- જેતપુર જુના પાંચપીપળા રોડ શ્રી જય શક્તી સોસાયટી વાળા ધોરાજી આવેલા અને તેઓ અન્ય મહિલા આગેવાનો ક.૧૪/૪૫ વાગ્યે ધોરાજી જીનપ્લોટ મેઇન રોડ ઉપરથી ચાલીને કાર્યક્રમમાં જતા હતા તે વખતે એક કાળા કલરના સી.બી.ઝેડ જેવા મોટર સાયકલ વાળાએ મોટર સાઇકલ ઉપર આવી મીનાક્ષીબેન રામજીભાઈ સોજીત્રા ઉ.વ.૫૨ રહે- જેતપુર જુના પાંચપીપળા રોડ શ્રી જય શક્તી સોસાયટી વાળીના ગળામાંથી સોનાની માળા ત્રણ તોલાની કિ.રૂ.૭૫,૦૦૦/- ની ચીલઝડપ કરી લઇ જતા તેઓએ ફરીયાદ જાહેર કરતા ધોરાજી પો.સ્ટે.ગુ.ર.ન.૧૬/૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬ મુજબ ગુન્હો દાખલ કરી નાકાબંધી કરી સ્થાનિક પોલીસની મદદથી સાચી દિશામાં તપાસ કરતા કરાવતા ગણતરીની કલાકોમાં આ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક્ટ કરી ચીલઝડપમાં ગયેલ અસલ સોનાની માળા ૪૦.૮૦ ગ્રામ કિ.રૂ.૭૫,૦૦૦/- ની રીકવર કરી આરોપી નીશાંત કિશોરભાઈ કપુપરાએ ગુન્હામાં વાપરેલ સી.બી.ઝેડ મો.સા નં.ઉજ-૨૩-૯૨૧૩ ની કિ.રૂ.૨૫,૦૦૦/- નું કબ્જે કરી આ ગુન્હાના કામે આરોપી (૧) નીશાંત કિશોરભાઈ કપુપરા ઉ.વ.૨૭ રહે- મુળ ઉપલેટા સ્વામી નારાયણ સોસાયટી હાલ- જુનાગઢ જોષીપુરા બાપુનગર (૨) શાહિદ ગનીભાઈ તરકવાડીયા ઉ.વ.૨૭ રહે- નવાગઢ ખાટકીવાસ તા. જેતપુર વાળાઓની ધરપકડ કરેલ છે.

આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી સાચી દિશામાં પુછપરછ કરતા જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૭/૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯,૩૫૬ મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી આ કામે ચીલઝડપમાં ગયેલ ફરીયાદીનો અસલ સોનાનો ચેઇન કિ.રૂ.૨૦,૦૦૦/-નો રીકવર કરેલ છે. તેમજ જુનાગઢ 'સી' ડી.વી પો.સ્ટે ગુ.ર.ન.૧૮/૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯,૩૫૬ મુજબ નો ગુન્હો ડીટેક્ટ કરી આ કામે ચીલઝડપમાં ગયેલ ફરીયાદીનો જોલો કંપનીનો અસલ મોબાઇલ ફોન કિ.રૂ.૮૨૦૦/- નો રીકવર થયેલ છે.

ઉપર મુજબના ચિલઝડપના ગુના શોધી કાઢવાની સારી કામગીરી કરવા બદલ ધોરાજી પો.સ્ટે ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આઇ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ શ્રી આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ નીરૂભા વાળા તથા આ કામગીરીમાં મહત્વનો ફાળો આપનાર પોલીસ સ્ટાફનું જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તથા ફરીયાદી શ્રીમતી મીનાક્ષીબેન રામજીભાઈ સોજીત્રા ઉ.વ.૫૨ રહે- જેતપુર જુના પાંચપીપળા રોડ શ્રી જય શક્તી સોસાયટી વાળાએ તા.૧૨/૦૨/૨૦૧૪ ના રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુરની કચેરીએ આ સુંદર કામગીરી કરવા બદલ ઉપરોક્ત પોલીસ અધિકારી/કર્મચારીઓનો

સન્માનનો કાર્યક્રમ યોજી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધોરાજી, પો.સબ.ઇન્સ શ્રી આર.એચ.ઝાલા તથા આ કામગીરીમાં મહત્વનો ફાળો આપનાર ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને સીલ્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં જેતપુરના આગેવાનો હાજર રહેલ હતા. અને આ કાર્યક્રમના લેવાયેલ ફોટોગ્રાફ નીચે મુજબ છે.







લુટનો ગુનો શોધી કાઢ્યો

જસદણ પો.સ્ટે.,ગુ.ર.નં.૧૦/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪,૩૬૫,૧૧૪ મુજબ નો બનાવ તા.૨૩/૧/૨૦૧૪ ના રાત્રીના દશેક વાગ્યાના સુમારે જસદણ તાબેના જંગવડ ગામના બસ સ્ટેન્ડ પાસે બનેલ છે. અને તા.૨૫/૧/૧૪ ના કલાક ૧૩-૩૦ વાગ્યે જાહેર થયેલ છે.આ કામે ફરીયાદી શ્રી યોગેન્દ્રભાઈ ભગવાનભાઈ યાદવ જાતે યાદવ ઉવ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે બુળ બંધા નાના બીદીયા જી.આરા. રાજ્ય બિહાર હાલ બેટગામ જામનગર, રીલાયન્સ ઇન્ડ.એરીયા મો.નં-૭૪૦૫૬-૮૧૧૮૯ વાળા પોતાના હવાલાવાળુ કન્ટેનર નંબર જી.જે.૬ ૬બલ્યુ-૭૫૪૫માં પ્લાસ્ટીક ના દાણા બોરી નંગ-૧૦૪૦ ભરી નીકળતા જંગવડ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના ચાર અજાણ્યા ઇસમોએ ફરીયાદીને આંતરી ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ કન્ટેનરમાંથી બોરી નંગ-૪૨૬ કિ.ગ્ર., ૬,૦૦૦૦/- (છ લાખ) ની લુંટ ચલાવી લઇ જતા બનાવ બનેલ હતો. એલ.સી.બી. અમરેલીએ આ કામના આરોપીઓ (૧) રામજીભાઈ ધનશ્યામભાઈ રંગાણી ઉવ.૨૪ રહે ઘોબા તા.સાવરકુંડલા જી.અમરેલી (૨) રાજુ ઉર્ફે ભાણો ધીરુભાઈ ઓગાણીયા ઉવ.૨૮ રહે રાણીગામ તા.ગારીયાધાર (૩) હરેશ ઉર્ફે હરી પરસોતમભાઈ શેખડા પટેલ ઉવ.૩૫ રહે પાડરસીંગા તા.લાઠી અમરેલી વાળાઓને સી.આર.પી.સી.ક.૪૧ (૧)ડી મુજબ અટક કરી સઘન પુછપરછ કરતા આરોપી ઓએ આ લુંટના ગુન્હાની કબુલાત કરતા આરોપીઓને જસદણ પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી આ લુટનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

નાસતા ફરતા આરોપી પકડી પાડ્યા :-

- (૧) ડભોઇ પો.સ્ટે.(વડોદરા ગ્રામ્ય) ગુ.ર.નં.૪૮/૨૦૦૯ આઇ.પી.સી.કલમ-૩૭૯ ના કામે નાસતા ફરતા આરોપી રવી ઉર્ફે વિજય લક્ષ્મણ સોલંકી દેવીપૂજકઉ.વ.૨૫રહે.ગોંડલ બાલાશ્રમ પાસેવાળાની હકિકત આધારે તા.૧૩/૦૨/૨૦૧૪ ના કલાક- ૦૨/૧૫ વાગ્યે ગોંડલ હોસ્પિટલ ચોક પાસેથી પકડી પાડેલ છે.
- (૨) ગોંડલ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૦૯/૨૦૧૩ આઇ.પી.સી.કલમ-૩૨૩,૩૨૫, ૫૦૪,૧૧૪ વિગેરેના કામે નાસતા ફરતા આરોપી કેશુભાઈ બચુભાઈ ઉર્ફે મચ્છુ ચારોલા દેવીપૂજકઉ.વ.૪૫રહે.મુળ- વાંસાવડતા.ગોંડલ હાલ રહે.-પેઢલાતા.જેતપુર વાળાની હકિકત આધારે તા.૧૫/૨/૨૦૧૪ ક- ૧૬-૪૫ વાગ્યે જામવાડી પેટ્રોલ પંપ પાસેથી પકડી પાડેલ છે.
- (૩) ગોંડલ સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૦/૨૦૧૩ આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦,૧૧૪ ના કામે નાસતા ફરતા આરોપી વિપુલગીરી ઝવેરગીરી ગોસાંઇ ઉ.વ.૩૩રહે.રાજકોટકોઠારીયા મેઇન રોડ વાળાને હકિકત આધારે તા.૧૬/૨/૨૦૧૪ ના કલાક ૦૧/૩૦ વાગ્યે ગોંડલ ગુંદાળા ચોકડી પાસેથી પકડી પાડેલ છે.